

Mastek Limited

#106,107 SDF-IV Seepz, Andheri (East), Mumbai 400096, Maharashtra, India

T +91 22 6722 4200 F +91 22 6695 1331 W www.mastek.com

SEC/14/2021-22 April 27, 2021

Listing Department BSE Limited

25th Floor, Phiroze Jeejeebhoy Towers

Dalal Street, Fort Mumbai - 400 001.

Tel No. 022- 22723121 Fax No. 022- 22721919

SCRIP CODE : 523704

Listing Department

The National Stock Exchange of India Limited

Exchange Plaza, C-1, Block G,

Bandra Kurla Complex,

Bandra (E), Mumbai – 400 051

Tel No.: 022-26598100 Fax No. 022-26598120

SYMBOL: MASTEK

Dear Sir(s)/Madam(s),

Sub: Newspaper Clippings - Advertisement of notice of Meetings of Equity Shareholders and Unsecured Creditors of Mastek Limited ("the Company"), to be held pursuant to the directions of the Ahmedabad Bench of the Hon'ble National Company Law Tribunal.

Ref: Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations").

This is with reference to our intimation letter No. SEC/10/2021-22 dated April 23, 2021, informing about the Meetings of Equity Shareholders and Unsecured Creditors of the Company, to be held on Friday, May 28, 2021, pursuant to the directions given by the Ahmedabad Bench of the Hon'ble National Company Law Tribunal vide its Order dated April 12, 2021, in the matter of the proposed Scheme of Arrangement between Evolutionary Systems Private Limited, Trans American Information Systems Private Limited and Mastek Limited and their respective Shareholders and Creditors.

In this regard, we enclose herewith copies of the advertisement of notice of aforesaid Meetings, given in the following newspapers yesterday, i.e., Monday, April 26, 2021:

Business Standard, all India Editions, in English language; and

Jai Hind, Ahmedabad Edition, in Gujarati language

This is for your information and dissemination on your website.

Thanking you,

Yours faithfully,

For Mastek Limited

Company Secretary



Encl: AA

SRIKALAHASTHI PIPES LIMITED

Regd. Office & Works: Rachagunneri-517 641 Srikalahasthi Mandal, Chittoor District, AP, India Website: www.srikalahasthipipes.com E-mail: companysecretary@srikalahasthipipes.com Phone: 08578 – 286650 – 286655, Fax: 08578-286688 CIN: L74999AP1991PLC013391

NOTICE

Pursuant to Regulation 29 (1) read with Regulation 47 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Tuesday the 4th May, 2021 interalia, to consider and approve Audited Financial Results of the Company for the quarter and year ended 31st March, 2021 and ecommend dividend, if any.

The said Notice may be accessed on the Company's website at www.srikalahasthipipes.com and on the websites of Stock Exchanges at ww<u>w.nseindia.com</u>

For Srikalahasthi Pipes Limited G. KODANDA PANI Company Secretary Place: Rachagunneri Date: 25.04.2021



NSE Clearing Limited CIN: U67120MH1995PLC092283

Registered Office: "EXCHANGE PLAZA", C-1, Block 'G', Bandra-Kurla Complex, andra (East), Mumbai 400051, Tel: +91-22-26598222, Fax: +91-22-26598198 Email: secretarialdept@nse.co.in Website: www.nscclindia.com

NOTICE

Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Wednesday, May 05. 2021, inter-alia, to consider and approve the audited financial results of the Company (both stand-alone and consolidated) for the guarter and year ended as on March 31, 2021 and to recommend dividend, if any, for the financial year 2020-21 as recommended by the Audit Committee of the Board

The above information is also available on the website of the Company at www.nscclindia.com

For **NSE Clearing Limited** Date: April 26, 2021 Chirag S. Nagda Place: Mumbai Company Secretary

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL AHMEDABAD BENCH, AT AHMEDABAD
COMPANY SCHEME APPLICATION NO. CA (CAA) NO. 18(AHM)2021. In the matter of Companies Act, 2013;

AND In the matter of Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013; AND

In the matter of Scheme of Arrangement between Evolutionary Systems Private Limited, Trans American Information Systems Private Limited and Mastek Limited.

EVOLUTIONARY SYSTEMS PRIVATE LIMITED

(CIN: UI7122GJ2006PTC049073) a Company incorporated under the Companies Act, 1956 having its Registered Office at

...Applicant Demerged Company

... Applicant Resultant Company 1

...Applicant Resultant Company 2

11th floor, Kataria Arcade, Besides Adani Vidya Mandir School, SG Highway, Ahmedabad - 380054.

TRANS AMERICAN INFORMATION SYSTEMS PRIVATE LIMITED

(CIN: U51505GJ1999PTC112745) a Company incorporated under the Companies Act, 1956 having its Registered Office at

804/805, President House, Opp. C. N. Vidyalaya, Near Ambawadi Circle, Ambawadi, Ahmedabad - 380006.

Guiarat, India

MASTEK LIMITED

(CIN: L74140GJ1982PLC005215) a Company incorporated under the Companies Act, 1956 having its Registered Office at

804/805, President House, Opp. C. N. Vidyalaya, Near Ambawadi Circle, Ambawadi, Ahmedabad - 380006.

NOTICE AND ADVERTISEMENT OF NOTICE OF THE MEETING OF EQUITY SHAREHOLDERS OF MASTEK LIMITED AND MEETINGS OF UNSECURED CREDITORS OF EVOLUTIONARY SYSTEMS PRIVATE LIMITED, TRANS AMERICAN INFORMATION SYSTEMS PRIVATE LIMITED AND MASTEK LIMITED.

NOTICE is hereby given that by an Order dated April 12, 2021, in Company Application No. CA(CAA)-18(AHM)2021 ("Order"), the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench at Ahmedabad ("NCLT/ Tribunal") has inter-alia ("Order"), the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench at Ahmedabad ("NCLT/ Tribunal") has inter-alia directed Separate Meetings to be held of the Unsecured Creditors of Evolutionary Systems Private Limited ("Applicant Demerged Company" or "ESPL") and the Unsecured Creditors of Trans American Information Systems Private Limited ("Applicant Resultant Company 1" or "Mastek"), for the purpose of considering and if thought fit, approving, with or without modification(s), the proposed Scheme of Arrangement ("Scheme") between ESPL. TAISPL and Mastek ("Companies") and their respective Shareholders and Creditors, pursuant to the provisions of Sections 230 to 232 and any other applicable provisions of the Companies Act, 2013 ("Act"), at such date and time, mentioned hereinafter, as decided by the Companies in consultation with the Chairperson of the Meetings in terms of the Order.

In pursuance of the Order read with General Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") viz., Circular No. 14 dated April 08, 2020, Circular No. 17 dated April 13, 2020, Circular No. 20 dated May 05, 2020 read with Circular No. 02 dated January 13, 2021 ("MCA Circulars") and the SEBI vide its Circular No. SEBI/HO/CFD/ CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 read with SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 ("SEBI Circulars"), further notice is hereby given that Meetings of Unsecured Creditors of ESPL and TAISPL and Meetings of Equity Shareholders and Unsecured Creditors of the Mastek will be held through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") without heaving and Equity Shareholders and Equ physical presence at common venue, at the respective time as mentioned below, the said Unsecured Creditors and Equity

Sr. No.	Class of Meetings	Date of Meetings	Time (IST)
1	Unsecured Creditors of ESPL	Friday, May 28, 2021	10.00 a.m.
2	Unsecured Creditors of TAISPL		11.30 a.m.
3	Unsecured Creditors of Mastek		01.00 p.m.
4	Equity Shareholders of Mastek		05.00 p.m.

Copy of the Scheme of Arrangement, the Explanatory Statement under Section 230(3) read with Section 102 and other applicable provisions of the Act read with Rule 6 of the Companies (Compromises, Arrangements and Amalgamation) Rules, 2016 ("CAA Rules") and Annexures thereat can be accessed/ downloaded from the website of the Company at: www.mastek.com and on the website of the Stock Exchanges, i.e., BSE and NSE at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of National Securities Depository Limited at www.evoting.nsdl.com. If so desired, person may obtain a and on the website of National Securities Depository Limited at www.evoting.nsdi.com. It so desired, person may obtain a printed copy of the Scheme the Explanatory Statement under Section 230(3) read with Section 102 and other applicable provisions of the Act read with Rule 6 of CAA Rules, etc., free of charge from the Registered Office of the ESPL, TAISPL and Mastek or from the office of the PCA Mr. Sanjay Majmudar at B-303 at GCP Business Centre, Opp. Memnagar Fire Station, Near Vijay Rasta, Ahmedabad - 380014, during normal business hours between (9:30 am and to 6:30 pm.) from Monday to Friday upto and including the date of the Meeting. Pursuant to the said Order read with the MCA Circulars and the SEBI Circulars, voting at the above Meetings shall not be permitted through proxies.

The Hon'ble NCLT has appointed Mr. S. Sandilya and failing him Mr. Ashank Desai, to be the Chairperson of the said Meetings. The Scheme of Arrangement, if approved in the aforesaid Meetings, will be subject to the subsequent approval of the other regulatory authorities and sanction by the Hon'ble NCLT. FURTHER NOTICE is hereby given that:

- 1) In compliance with the Order read with MCA Circulars and SEBI Circulars and provisions of Section 230(4) read with Section 108 of the Act, read with Rule 20 and other applicable provisions of the Companies (Management and Administration) Rules, 2014 and in accordance with Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 and Paragraph 9 of the Circular No. CFD/DIL3/CIR/2017/21 dated March 10, 2017, issued by the SEBI, the business as set out in notices for aforesaid Meetings be transacted through e-voting means by way of remote e-voting facility and e-voting facility during the Meetings. The Companies are providing facility for remote e-voting and e-voting during Meetings through National Securities Depository Limited ("NSDL"). The necessary instructions for remote e-voting and e-voting during Meetings have been set out in the notices dated April 23, 2021. This Facility is being provided to the Equity Shareholders of Mastek holding shares in physical and dematerialised form as on cut-off date i.e. May 19, 2021 and Unsecured Creditors of ESPL, TAISPL and Mastek as on cut-off date i.e. December 15, 2020.
- 2) ESPL and TAISPL on April 23, 2021 and Mastek on April 24, 2021 has completed the dispatch of the Notice of Meetings of the Unsecured Creditors and the Explanatory Statement thereto by electronic mode upon all its Unsecured Creditors as on December 15, 2020. The voting rights as well as value of vote of the Unsecured Creditors shall be in proportion to outstanding amount due to them by the ESPL, TAISPL and Mastek as on December 15, 2020 being the cut-off date. A person/entity who is not an Unsecured Creditor of ESPL, TAISPL and Mastek as on the cut-off date should treat the notice of Meeting of the Unsecured Creditors for information only.
- 3) Mastek has on April 23, 2021 also completed the dispatch of the Notice of Meeting of the Equity Shareholders and the Explanatory Statement thereto by electronic mode to those Equity Shareholders whose e-mail IDs are registered with the Mastek/ Depositories as on March 31, 2021. The voting right of the Equity Shareholders shall be in proportion to the value of fully paid equity shares of the Mastek held by them as on May 19, 2021 being the cut-off date. A person who is not an Equity Shareholder of Mastek as on the cut-off date should treat the notice of Meeting of the Equity Shareholders for
- The remote e-voting period for the aforesaid Meetings of Equity Shareholders and Unsecured Creditors will commence on Monday, May 24, 2021 at 9.00 am (IST) and shall end on Thursday, May 27, 2021 at 5:00 pm (IST). During this period, Equity Shareholders and Unsecured Creditors as on their respective cut-off dates, may cast their vote by remote e-voting. The remote e-voting module shall be disabled by NSDL for voting at 5.00 pm on Thursday, May 27, 2021. Once the vote on the resolution is cast by an Equity Shareholders and Unsecured Creditors through remote e-voting, he or she will not be allowed to change it subsequently. The casting of votes by remote e-voting does not disentitle the Equity Shareholders and the Unsecured Creditors from

attending and participating in the Meetings, however, those who have already voted prior to the Meetings date would not be entitled to vote at the Meetings. Votes may be cast at the Meetings and those who have not cast their vote before the Meetings shall be entitled to exercise their right at the Meetings. 5) Equity Shareholders of Mastek as on cut-off date i.e. March 31, 2021 who have not registered their email addresses with the

- Mastek/Depositories may follow the process detailed below for the registration of their email address
- a) For members holding shares in physical mode please provide Folio No., Name of member, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to investor_grievances@mastek.com b) Members Holding shares in Demat mode please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card),
- AADHAR (self-attested scanned copy of Aadhar Card) to investor_grievances@mastek.com or evoting@nsdl.co.in c) Unsecured Creditors of the Applicant Demerged Company, Applicant Resultant Company 1 and Applicant Resultant Company 2, as on cut-off date i.e. December 15, 2020 may send e-mail request to NSDL at evoting@nsdl.co.in providing their name, address, amount outstanding and PAN.
- The NCLT vide its Order dated April 12, 2021 has appointed Mr. Prashant S. Mehta, Practicing Company Secretary, as the Scrutiniser to scrutinise e-voting during the Meetings and voting through remote e-voting in a fair and transparent manner. The Scrutiniser will make a consolidated Scrutiniser's Report of the total votes cast in favor and against the resolutions and invalid votes, if any, to the Chairperson of the Meetings, in writing.
- The results of the Meetings alongwith Scrutiniser's Report would be displayed at the Registered Office of the ESPL, TAISPL and Mastek. Results of Meetings of the Equity Shareholders and Unsecured Creditors of Mastek shall also be displayed on its website at www.mastek.com, on the websites of Stock Exchanges where its securities are listed and on the website of NSDL at www.evoting.nsdl.com and Results of Meetings of Unsecured Creditors of ESPL and TAISPL shall be displayed on the website of NSDL at www.evoting.nsdl.com.
- 8) In case of any grievance connected with the remote e-voting and e-voting during the Meetings, the Equity shareholders and the Unsecured Creditors may call NSDL on toll free number 1800 1020 990/ 1800 224 430.
- 9) In order to express their views and to seek explanations pertaining to Scheme of Arrangement during the Meeting the concerned Equity Shareholders are requested to register themselves as Speaker at least 2 (two) days prior to the Meeting by sending request from their registered e-mail address mentioning their name, demat account number/folio number, e-mail id, mobile number at investor_grievances@mastek.com

Place: Ahmedabad Date : April 24, 2021

S. Sandilva

Chairperson appointed by the Hon'ble NCLT for the Meetings of Equity Shareholders of Mastek Limited and Unsecured Creditors of

Business Standard

MUMBAL EDITION

Printed and Published by Sangita Kheora on behalf of Business Standard Private imited and Printed at M/s. Dangat Media Private Limited, 22 Digha M.I.D.C., TTC Industrial Area, Vishnu Nagar, Digha, Navi Mumbai, 400708 and M/s. Nai Dunia 23/4, 23/5, Sector-D. Industrial Area, J.K. Road, Near Minal Residency, Bhopal

(M.P.)-462023. & Published at H/4 & I/3. Building H. Paragon Centre. Opp Birla Centurion, P.B.Marg, Worli, Mumbai- 400013

Editor: Shyamal Majumdar

RNI NO: 66308/1996 Readers should write their feedback at feedback@bsmail.ir Fax: +91-11-23720201

For Subscription and Circulation Ms. Mansi Singh **Head-Customer Relations** Business Standard Private Limited. H/4 & I/3, Building H,Paragon Centre, Opp Birla Centurion, P.B.Marg, Worli

> Mumbai - 400013 E-mail: subs_bs@bsmail.in or sms, REACHBS TO 57575

Overseas subscription: (Mumbai Edition Only)

One year subscription rate by air mai INR 51765 : USD 725

DISCLAIMER News reports and feature articles i Business Standard seek to present an unbiased pic ture of developments in the markets, the corporate world and the government. Actual developmer can turn out to be different owing to circumstance eyond Business Standard's control and knowledge Business Standard does not take any responsibilit for investment or business decisions taken by read ers on the basis of reports and articles published in the newspaper. Readers are expected to form the

wn judgement. usiness Standard does not associate itself with or stand by the contents of any of the advertisements accepted in good faith and published by it. Any claim related to the advertisements should be directed to the advertisers concerned

Unless explicitly stated otherwise, all rights reserved by M/s Business Standard Pvt. Ltd. Any printing, ublication, reproduction, transmission or i ination of the contents, in any form or by any means, is prohibited without the prior written consent of M/s Rusiness Standard Pvt Ltd. Any such ohibited and unauthorised act by any person/lega ntity shall invite civil and criminal liabilities

No Air Surcharge

E-AUCTION SALE NOTICE

(Sale of Kwality Limited (In Liquidation) as Going Concern under Insolvency and Bankruptcy Code, 2016)

Sale of Kwality Ltd. ("Company or Corporate Debtor") (In Liquidation) or its business as a going concern under Regulations 32A of the of the Insolvency and Bankruptcy Board of India (Liquidation Process) Regulations, 2016 ("Liquidation Regulations") by the Liquidator appointed by the Hon'ble Adjudicating Authority, National Company Law Tribunal, New Delhi Bench-III ("NCLT") vide order dated 11 January 2021. The sale will be done by the undersigned through e-auction platform at the web portal of https://right2vote.in/. The E-Auction will be live on the portal from 10:00 A.M. 12 May 2021 to 6:00 P.M. 12 May 2021 for submitting the bids.

The details of the Assets of the Corporate Debtor	Reserve Price (INR Cr.)	EMD Amount (INR Cr.)	Minimum Incremental Bid (INR Cr.)		
Sale of Kwality Ltd. (In Liquidation) or its business as going concern under Regulations 32A of the Liquidation Regulations (Refer Annexure G of the Process Memorandum dated 15th April 2021)	₹ 140.00 Cr.	₹ 7.00 Cr.	₹ 1.00 Cr.		

Terms and Condition of the E-auction are as under

- E-Auction will be conducted on "AS IS WHERE IS" and "WHATEVER THERE IS BASIS" through approved service provider Right2Vote.
 E-Auction tender document containing online e- auction bid form, Declaration, General Terms and condition of online auction sale are available on websites, https://right2vote.in/. Contact: +91-9920591306 Email Id: contact@right2vote.in (On clicking the link, available on websites, https://ngit.evoite.iii/.comact.-+91-93209509 Entail tit. contactioning revoite.iii/(on clicking the link thtps://rightl2vote.ii/ interested bidders will have to search for the mentioned company by using either one of the two options, (i) Company's name [Kwelity Limited (In Liquidation)], or by, (ii) State and property type).
- You may also contact the representatives through email at liquidator.kwality@in.ey.com for further details about the compan The intending bidders prior to submitting their bid, should make their independent inquiries regarding the encumbrances, title of property
- claims/rights/dues/affecting the property, inspect the property at their own expenses and satisfy themselves.

 The intending bidders are required to deposit Earnest Money Deposit (EMD) of INR 7 crores either through NEFT/RTGS in the Account No-605920110000297, Bank of India, New Delhi Large Corporate Branch, New Delhi – 110001, IFSC CODE: BKID0006059 or by way of demand draft drawn in the favour of Kwality Limited (In Liquidation), drawn on any Schedule Bank.
- The intending bidder should submit the evidence for deposit of EMD and request letter for participation in the E- auction along with self-attested copy of (1) Proof of identification (2) current Address-proof (3) PAN card (4) Valid e-mail ID (5) contact details to the office of the Liquidator or by email at address given below before 6:00 P.M. 1 May 2021.
- Name of the eligible bidders will be notified by the Liquidator for participation in online e-auction. The e-auction service provider will provide
- User ID and password by email to eligible bidders. In case bid is placed in the last 5 minutes of the closing time of the e-auction, the closing time will automatically get extended for 5 minutes
- with unlimited extension. The bidder who submits the highest bid amount (not below the reserve price) on closure of e-Auction process shall be declared as Successful bidder and a communication to that effect will be issued through electronic mode which shall be subject to approval by the Liquidator.
- The EMD of the successful bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidders shall be refunded. The EMD shall not bear any interest. The successful bidder shall have to deposit the balance consideration (after adjustment of the EMD) of the sale price within 30* days on issuance of Loli.e. acceptance of bid price by the Liquidator by 23 June 2021. Default in deposit of amour by the successful bidder would entail forfeiture of the EMD.
- The purchaser shall bear the applicable stamp duties/transfer charge, fees etc. and all the statutory / non-statutory dues, taxes, rates essment charges, fees etc. in respect of purchase of the property through auction. The Liquidator has the absolute right to accept or reject any or all offer (s) or adjourn/postnope/cancel the e-Auction or withdraw any
- property or part thereof from the auction proceeding at any stage without assigning any reason there for. The details of the assets of the Corporate debtor is appexed as Appexure G of the Process Memorandum dated 15 April 2021 uploaded or
- Virtual Data Room The assets mentioned in the Annexure G of the Process Memorandum dated 15 April 2021 are lying charged with the secured financia creditors and majority of the secured financial creditor have not relinquished their security interests under Section 52 of the IBC. This will be negotiated with the secured financial creditors and addressed by the Liquidator during the sale process. Further, the Liquidator reserve the right to extend the timeline of the sale process set out in the Process Memorandum dated 15 April 2021 read with as amended vide
- lendum dated 26 April 2021. The sale certificate/agreement will be issued in the name of the successful bidder only and will not be issued in any other name
- The sale shall be subject to provisions of Insolvency and Bankruptcy Code, 2016 and the regulations made thereunder
- E-auction date & Time: 10:00 A.M. 12 May 2021 to 6:00 P.M. 12 May 2021 (with unlimited extension of 5 min) * The timeline for payment of final sale consideration may be extended at the sole discretion of Liquidator, to the extent permissible under the

applicable laws and regulations. In case the final sale consideration is not paid within the timeline, the Liquidator shall forfeit the EMD.

Liquidator, Kwality Ltd. (In Liquidation)^
Address: EY Restructuring LLP, 3rd Floor, Worldmark 1, Aerocity Hospitality, New Delhi, National Capital Territory of Delhi-110037
Email Id: Shailendra.ajmera@in.ey.com, Registration no. IBBI/IPA-001/IP-P00304/2017-18/10568, Email: liquidator.kwality@in.ey.com Shailendra Ajmera has been granted a certificate of registration to act as a Liquidator by the Insolvency and Bankruptcy Board of India. The affairs, business and property of Kwality Ltd. are being managed by the Liquidator, Shailendra Ajmera, who acts as agent of Kwality Ltd. only and without personal liability

Place: New Delhi, Date: 26 April 2021

^pursuant to Order dated 11 January, 2021 passed by the NCLT



SUBSCRIBE FOR

Get 2 years' access to all premium content on business-standard.com, our world class e-paper, curated newsletters, archives and more at just ₹1,799 the price of annual subscription!



Limited period offer. Visit bit.ly/DigitalUtsav or scan this code to Subscribe Now





content, handpicked

by our editors





across devices



Curated newsletters on Markets, Personal Finance, Policy & Politics, Technology, Startups & more







Business Standard

Insight Out

f bsindia

























business-standard.com

સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૦ રૂપિયા ઘટ્યું

ભારતમાં સોના-ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો

નવી દિલ્હી, તા. ૨૫ ચાલી રહી છે. સોના અને ચાંદીની માંગમાં

સુસ્તી આવવાને કારણે બન્ને ૪૪૯૫૦ અને ૨૪ કેરેટ સોનું ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો ધાતુની કિંમતમાં ઘટાડો યથાવત ૪૫૯૫૦ પર ચાલી રહ્યું છે. છે. પરંતુ તે ખુબ સામાન્ય છે. છે. રિવવારે કારોબારમાં કોલકત્તામાં ૨૨ કેરેટ સોનું આજે બજારમાં ચાંદીનો ભાવ સોનાના ભાવમાં ફરી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનીક સોની બજારમાં માંગ સુસ્ત પડવાથી સોનું ૧૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઘટી ૪૬૨૫૦ રૂપિયા થઈ ગયું છે. તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ ૪૬૩૬૦ રૂપિયા ૪૭૪૪૦ રૂપિયા છે, તો ૨૪ કોલકત્તામાં પણ આજ ભાવ છે. પ્રતિ ૧૦ ગ્રામ બંધ થયો હતો. કેરેટસોનું ૪૯૭૧૦ રૂપિયા છે. પરંતુ ચેન્નઈમાં ૭૪ હજાર પ્રતિ આ ભાવ વેબસાઇટ ગુડ રિટર્ન ચેન્નઈમાં પણ સોનાના ભાવમાં કિલો ભાવ પહોંચી ગયો છે. પ્રમાણે છે. જો મહાનહરોની વાત ઘટાડો જોવા મળ્યો છે. અહીં સોનાની કિંમત ૫૦,૪૭૦ રૂપિયા છે. આ કિંમત પ્રતિ ૧૦ કરવાને જણાવ્યું છે.

મુંબઈમાં ૨૨ કેરેટ સોનું

સોના-ચાંદીની માગમાં સુસ્તીને પરિણામે

ગ્રામ સોનાની છે.

સોનાની જેમ ચાંદીના ૬૮ હજાર ૭૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

જો અલગ-અલગ શહેરોમાં ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદી ૬૮૭૦૦ રૂપિયા પ્રતિ **કિંમતોમાં ઘટાડો** કિલોગ્રામ છે. મુંબઈ અને

બજાર નિષ્શાંતોએ સોનાની કરીએ તો તાજા ભાવ અનુસાર ૨૨ કેરેટ સોનાની કિંમત વાયદા કિંમતોમાં ઘટાડો દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની ૪૪૭૭૦ અને ૨૪ કેરેટ આવવાનું કારણ કારોબારીઓ કિંમત ૪૬૨૫૦ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૮૮૪૦ દ્વારા પોતાના સોદામાં ઘટાડા



દેશમાં કોરોના મહામારી વિકરાળ બનતા જુદા જુદા રાજ્યોમાં લોકડાઉન,કરફ્યુ, કલમ-૧૪૪ જેવા પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયેલા છે. લગ્નપ્રસંગ સહિતના સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં પણ મર્યાદિત સંખ્યામાં હાજરીના નિયમો વચ્ચે કેરાલાના કોચિ. શહેરમાં લાગુ લોકડાઉન દરમિયાન લગ્ન સમારંભના સ્થળ બહાર તૈનાત પોલીસને એક નવપરણિત દંપતિ ચા ની ઓફર કરી રહ્યા છે.

ઓરિસ્સા કોરોના સામેની લડાઇમાં રાષ્ટ્રીય

સ્તરે મદદ કરશે - નિવન પટનાયક ભુવને થર, તા. ૨૫ થવાની ખબરો સામે આવી રહી છે.

ભારતમાં કોરોના વાયરસના ઓક્સિજનની અછતા કારણે કારણે સ્થિતિ ગંભીર બની છે. દર્દીઓના મોત થઇ રહ્યા છે.

કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક સાબિત એવામાં ઓરિસ્સા સરકાર અને થતાં દેશમાં કોરોનો કેસોની સંખ્યામાં ઉદ્યોગપતિ નવીન જિંદાલે ઘણાં ધરખમ વધારો થઇ રહ્યો છે. સ્થિતિ રાજ્યોમાં ઓક્સિજન સપ્લાઇ પૂરી એવી બની છે કે દર્દીઓને પાડવાનું વચન આપ્યું છે.

હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા,

ઓક્સિજન સંકટ વધી રહ્યું છે.

દેશમાં કોરોના વાયરસની બીજી



દેશમાં કોરોનાના થયેલા વિસ્ફોટને લઇને હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન્સ, એમ્બ્યુલન્સની અછત સર્જાયેલી છે. ઉત્તરપ્રદેશની શહેર આગ્રામાં કોરોનાની એક મહિલા દર્દી હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નહીં હોવાથી ઓક્સિજન માસ્ક લગાવીને સીડીના પગથિયા ઉપર બેઠેલી નજરે પડે છે.

કોરોના-રસીના ડોઝનો વૈશ્વિક આંકડો ૧-અબજ પર પહોંચ્યો

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૫ દુનિયાભરમાં એક વર્ષથી પણ વધારે સમયથી હાહાકાર મચાવી રહેલા કોરોનાવાઈરસ રોગચાળાને અંક્રશમાં રાખવા માટે તમામ દેશોમાં નાગરિકોને આ વાઈરસ-વિરોધી રસી આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારત પણ એમાં બાકાત નથી. કોરોના-રસીના ડોઝની સંખ્યા વિશ્વસ્તરે ગઈ કાલે એક અબજના આંકને પાર કરી ગઈ છે. આ સાથે એવી આશા બળવત્તર થઈ છે કે આ રોગચાળાને વહેલી તકે અંકુશમાં લાવી શકાશે.

એએફપી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, દુનિયાના ૨૦૭ દેશો અને પ્રદેશોમાં શનિવાર, ૨૪ એપ્રિલ સુધીમાં ઓછામાં ૧,૦૦,૨૯,૩૮,૫૪૦ લોકોને કોરોના-વિરોધી રસી આપવામાં આવી ચૂકી છે. જોકે બીજી બાજુ આ મહાબીમારીના દૈનિક કેસના આંકડાએ પણ એક નવો વિક્રમ બનાવ્યો છે અને એનું મુખ્ય કારણ ભારતમાં આ રોગાચાળાનો થયેલો વિસ્ફોટક ફેલાવો છે. ગયા શુક્રવારે નવા કોરોના દર્દીઓનો આંકડો ૮,૯૩,૦૦૦ નોંધાયો હતો. ભારતમાં ગઈ કાલે નવા ૩,૪૬,૭૮૬ કેસ નોંધાયા હતા. રોગચાળો ફાટી નીકળ્યો ત્યારપછી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કોરોના-દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. દરમિયાન, ભારત દેશ માત્ર ૯૯ દિવસોમાં ૧૪ કરોડ નાગરિકોને કોરોના રસીના ડોઝ આપીને આટલા બધા ડોઝ આટલી ઝડપે

આપનાર દુનિયાનો પહેલો દેશ બન્યો છે. મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ માલિકે ખેડૂત આંદોલનને લઈને અપક્ષ ધારાસભ્યને લખ્યો પત્ર

મેં વડાપ્રધાન અને ગૃહમંત્રીને તે જણાવવાની કોશિશ કરી છે કે, તેઓ ખોટા રસ્તા પર છે ન્યુ દિલ્હી,તા.૨૫ પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. હરિયાણાના અપક્ષના ધારાસભ્યએ આંદોલનને લઈને ભવિષ્યમાં પણ આવી કોશિશો ચાલું

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન સાથે જ ગંભીર દર્દીઓને પટનાયકે ૨૨ એપ્રિલના રોજ ધારાસભ્ય સોમબીર સાંગવાનને રાજ્યપાલ સત્યપાલ મલિકને એક રાખીશ. તેના માટે જે પણ સંભવ ઓક્સિજનની અછત સર્જાઇ રહી પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી ખેડૂત આંદોલનને લઈને લખેલા પત્ર લખ્યો હતો. મલિકે તેવું કહીને હશે તે કરીશ.મલિક સાંગવાને છે. જેના કારણે દેશની ઘણી અને બાકીના રાજ્યોને મદદ એક પત્રમા મેઘાલયના રાજ્યપાલ જવાબી પત્ર લખ્યો છે કે, તેમને આગળ લખ્યું, હું તમને અને હોસ્પિટલોમાં કોરોના દર્દીના મોત કરવાની વાત કહી છે. ઓરિસ્સાની સત્યપાલ મલિકે કહ્યું, "મેં થયા છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ઝરુ ઓફિસ દ્વારા ટ્વીટ કરવામાં વડાપ્રધાન અને ગૃહમંત્રીને તે કહ્યું છે કે, ખેડૂતોને દિલ્હીથી ખાલી માંગુ છુ કે, તમારો સહયોગ ક્ચારેય એટલી નબળી બની છે કે ડૉક્ટરો આવી કે, કોરોનાની સેકન્ડ વેવ જણાવવાની કોશિશ કરી છે કે, પણ અસહાય મહેસૂસ કરી રહ્યા છે. એક યુદ્ધ જેવી સ્થિતિ છે. ઓરિસ્સા તેઓ ખોટા રસ્તા પર છે અને તેઓ ભારતનાં ઘણાં રાજ્યોમાં કોરોના સામેની લડાઇમાં રાષ્ટ્રીય કોશિશ ના કરે."

> જેના હેઠળ ઓક્સિજનનું આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ભાજપા-જેજેપી સરકાર પાસેથી

પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રીને પણ તમારી ખાપને વિશ્વાસ અપાવવા હાથે પરત આવવું જોઈએ નહીં.

અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ધારાસભ્ય સાંગવાને પહેલાથી અને ખેડૂતો સાથે ન્યાય કરવા અને કેન્દ્રએ તેનો ઉકેલ લાવીને તેમની નથી

છોડીશ નહીં. હું મેના પહેલા રાજ્યપાલે લખ્યું, મેં ખેડૂત સપ્તાહમાં દિલ્હી જઈ રહ્યો છું અને ખેડૂતોને દબાવવા, ડરાવવાની આંદોલનના મુદ્દા પર વડાપ્રધાન સંબંધિત બધા નેતાઓને મળીને ખેડૂતોના પક્ષમાં સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કરીશ. જણાવી જ ત્રણ કૃષિ કાયદાઓના મુદ્દા પર તેમની વાસ્તવિક માંગોને સ્વીકાર દઈએ કે , અત્યાર સુધી ખેડૂત કરવાની સૂચનો આપ્યા. મેં બેઠકમાં આંદોલન દરમિયાન ૩૦૦ તે પણ સ્પષ્ટ કર્યું છે કે, ખેડૂતોના ખેડૂતોના મોત થયા છે પરંતુ એક આંદોલનને દબાવી શકાય નહીં. વખત પણ સરકારે દુઃખ વ્યક્ત કર્યું

૧૦૩ વર્ષના સ્વતંત્રસેનાની બિરડીચંદ

દેશની આઝાદી માટે લડત કોરોના વાયરસ સંક્રમણને માત

નવેમ્બર ૧૯૧૭ છે. આવ્યો હતો અને શુક્રવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ગોઠીએ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા dfccil.com/ ની મુલાકાત ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર કહ્યું કે કોરોના વયારસ સંક્રમિત થયા બાદ ડોક્ટરોએ મારી સારવાર કરી. આ સાથે જ ઘરે રહેતા લોકોએ

તેમણે કહ્યું કે ઈશ્વરની કૃપાથી લડનારા ૧૦૩ વર્ષના હું ઠીક છું. સારવાર દરમિયાન સ્વતંત્રસેનાની બિરડીચંદ ગોઠીએ બધાનો સહયોગ મળ્યો. હું માનસિક રીતે ઠીક રહ્યો અને ખુશ આપી છે. તેઓ મધ્ય પ્રદેશના રહ્યો. ખાવા પીવાનું સારું રાખ્યું. બૈતુલના રહીશ છે અને આધાર કાર્ડ આથી જલદી સાર્જો થઈ ગયો. મુજબ તેમની જન્મતારીખ ૨ ગોઠીએ જણાવ્યું કે બાળપણથી મારી દિનચર્યા સારી રહી છે. સવારે 🗓 પ પાંચ એપ્રિલના રોજ બિરડીચંદ જલદી ઉઠવું, સંતુલિત અને સાદો ગોઠીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આહાર, નિયમિત વ્યાયામ અને પાઠ કરવા, તથા પ્રસમચિતથી પોતાના દરેક કામને કરું છું. પરંતુ

પોતાને બદલી નાખે છે. બિરડીચંદે કહ્યું કે 'આજકાલની પણ સહયોગ કર્યો હું ખુશ રહ્યો અને ખાણી પીણી રહેણી કરણી લોકોને

વર્તમાનમાં લોકો બદલાતા સમયમાં

अरिवल भारतीय श्री पंच रामानन्दीय खाकी अखाड़ा

अगत्य निवेदन

अभा श्री पंच रामानंदीय खाकी अखाडा गुरुवार को अंबाजी मंदिर, ज्मालपुर, अहम्दाबाद (गुज्रात) निवासी अर्जुनदास चेला भागीस्थ दास को अखाँड़े से बहिष्कृत कर दिया हैं। साथ ही उसके श्री रामजी मंदिर पादर मठ (खाकी अखाडा) ग्राम पादर, तहसील गनाडा, जिला बांसवाडा (राजस्थान) में प्रवेश प्रतिबंधित किया है । अखाड़े ने साधु समाज, मठ -मंदिरो, बैठकों, आश्रमों को सूचित किया कि अमर्यादित अर्जुनदास चेला

કોરોના વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવા રિલાયન્સ પણ તૈયાર

.....અરજદાર ડીમજર્ડ કંપની

..અરજદાર રિઝલ્ટન્ટ કંપની ૧

. .અરજદાર રિઝલ્ટન્ટ કંપની ૨

દેશમાં કોરોના ટિકાકરણનો ચોથો તબક્કો ૧ મે થી શરુ થઇ રહ્યો છે. જે અંતર્ગત ૧૮ વર્ષથી વધારે ઉંમરના બધા નાગરિકો વેક્સીનેશન કરાવી શકશે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કોરોના વેક્સીનેશન કાર્યક્રમ R-Surakshaaની જાહેરાત કરી છે. જે અંતર્ગત રિલાયન્સના ૧૮ વર્ષથી વધારે ઉંમરના બધા કર્મચારીઓ અને પરિવારના સભ્યોને ૧ મે થી મફત વેક્સીન લગાવવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડેના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા રિલાયન્સ પરિવારના બધા કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું કે ભારત હાલના સમયે કોરોનાના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીના કારણે દેશના ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર દબાશ છે. કોરોના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં આપણે વધારે સાવધાની રાખવાની જરૂર છે. મુકેશ અંબાણીએ રિલાયન્સના કર્મયારીઓને આશ્વત કર્યા છે કે રિલાયન્સ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાન કર્મચારીઓના ભલા માટે તેમની સાથે

મુકેશ અંબાણીએ કહ્યું કે કોવિડ વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત રિલાયન્સના ઘણા કર્મચારી વેક્સીનેશન કરાવી ચૂક્યા છે. રિલાયન્સ બધા કર્મચારીઓના વેક્સીનેશનનો ખર્ચ ઉઠાવી રહી છે અને આગળ પણ ઉઠાવશે. સરકાર દ્વારા જાહેર કરેલ કોરોના વેક્સીનેશનના નવા તબક્કાની સાથે રિલાયન્સ પોતાનો વેક્સીનેશન કાર્યક્રમ R-Surakshaaની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અમદાવાદ ખાતેની બેંચ સમક્ષ કંપની સ્કિમ અરજી નં. સીએ (સીએએ) ૧૮(એએચએમ) ૨૦૨૧ કંપનીધારા, ૨૦૧૩ની બાબતમાં

> કંપનીધારા, ૨૦૧૩ની સેક્શન્સ 230 થી 232 અને અન્ય લાગુ પડતી જોગવાઈઓની બાબતમાં

વચ્ચેની વ્યવસ્થાની સ્કિમની બાબતમાં

ઈવોલ્યુશનરી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, ટ્રાન્સ અમેરિકન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને માસ્ટેક લિમિટેડ

ઈવોલ્યુશનરી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (CIN:UI7122GJ2006PTC049073)

કંપનીધારા, ૧૯૫૬ હેઠળ સ્થપાયેલ કંપની જેની રજિસ્ટર્ડ ઓફિસ ૧૧મે માળે, કટારિયા આર્કેડ, અદાણી વિદ્યામંદિર સ્કૂલની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ-**૩૮૦૦૫૪**

ગુજરાત, ભારત. ટ્રાન્સ અમેરિકન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ

(CIN:U51505GJ1999P112745)

કંપનીધારા, ૧૯૫૬ હેઠળ સ્થપાયેલ કંપની જેની રજિસ્ટર્ડ ઓફિસ ૮૦૪/૮૦૫, પ્રેસિડન્ટ હાઉસ, સી.એન. વિદ્યાલય સામે, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬

ગજરાત. ભારત. માસ્ટેક લિમિટેડ

(CIN: L74140Gj1982PLC005215)

કંપનીધારા, ૧૯૫૬ હેઠળ સ્થપાયેલ કંપની જેની રજિસ્ટર્ડ ઓફિસ ૮૦૪/૮૦૫, પ્રેસિડન્ટ હાઉસ, સી.એન. વિદ્યાલય સામે, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬

ગુજરાત. ભારત

માસ્ટેક લિમિટેડ અને ઈવોલ્યુશનરી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, ટ્રાન્સ અમેરિકન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને માસ્ટેક લિમિટેડના અનસિક્યોર્ડ લેણદારો વચ્ચેની મીટિંગની નોટિસની નોટિસ અને જાહેરખબર

વજારાત વચ્ચા માહ-૧૫ માહિયા જો જાલ્યગમ અત્રે મીટિસ અપાવાની કે નામદાદ રોશાનલ કંપની લો ટ્રિબ્યુનલ, અમદાવાદ બેંચ <mark>(''એનસીએલટી/ટ્રિબ્યુનલ'')નો</mark> કંપની અરજી નં. સીએ (સીએએ)-૧૮(એએચએમ) ૨૦૨૧માં ૧૨મી એપ્રિલ, ૨૦૨૧ના આદેશ(<mark>''ઑર્ડર'')</mark> થી આદેશની શરતો અનુસાર અન્ય બાબતો સાથે, કંપનીઓ દ્વારા મીટિંગોના અધ્યક્ષ સાથે સલાહથી નક્કી કરેલ હવે પછી દર્શાનાર તારીખે અને સમયે, કંપનીધારા, ૨૦૧૩ (કાયદો)ની સેક્શન ૨૩૦થી ૨૩૦ અને અન્ય કોઈ લાગુ પડતી જોગવાઈઓ અનુસાર **માસ્ટેક લિમિટેડ અને** ઈવોલ્યુશનરી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ**("અરજદાર ડીમજર્ડ કંપની" અથવા "ઈએસપીએલ")**ના અનસિક્યોર્ડ લેણદારો, ટ્રાન્સ અમેરિકન ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ ("અરજદાર રિઝલ્ટન્ટ કંપની" ૧ અથવા "ટીએઆઈએસપીએલ")ના અનસિક્યોર્ડ લેણદારો અને માસ્ટેક લિમિટેડ ("અરજદાર રિઝલ્ટન્ટ કંપની" ૨ અથવા "માસ્ટેક")ના ઈક્વિટી શેરધારકો અને અનસિક્યોર્ડ લેણદારોની જુદી જુદી મીટિંગો ઈએસપીએલ, ટીએઆઇએસપીએલ અને માસ્ટેક અને તેમના સંબંધિત શેરધારકો અને લેણદારો વચ્ચે વ્યવસ્થા(એરેન્જમેન્ટ)ની પ્રસ્તાવિત યોજના (સ્ક્રિમ) અંગે વિચારણા કરવાના અને જો યોગ્ય લાગે તો સુધારા સાથે અથવા સુધારા વિના માન્ય કરવા માટેના હેતુથી યોજવાનો દિશાનિર્દેશ કરેલ.

તા લુતારા સાથ અથવા સુવારા પત્યા. નાત્ય કરવા નાટના હતુવા વાજવાના દિશાનિકશ કરતા. અને તો તા.૦૮મી એપ્રિલ, ૨૦૨૦ સર્ક્યુલર નં. ૧૭ તે તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ સર્ક્યુલર નં. ૧૭ તે તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, સર્ક્યુલર નં. ૧૦ તે તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, સર્ક્યુલર નં. ૧૦ તે તા. ૦૫મી મે, ૨૦૦૨ને સર્ક્યુલર નં. ૦૨ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ અને સેબીના સર્ક્યુલર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/11 તા૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ ("સેબી સર્ક્યુલર્સ") વંચાણે લીધા અનુસાર, આગળ અત્રે નોટિસ આપવાની કે ઈએસપીએલ અને ટીએઆઇએસપીએલના અનસિક્યોર્ડ લેણદારોની મીટિંગો નીચે આપેલ સંબંધિત સમયે વિડીયો કોન્ફરન્સિંગ (વીસી-"VC") /અન્ય ઓડિયોવિઝ્યુઅલ સાધનો("OAVM") દ્વારા, કોમન જગ્યાએ સભ્યોની શારીરિક હાજરી વગર યોજવાની રહેશે, જે સદરહુ અનસિક્યોર્ડ લેણદારો અને ઇક્વિટી શેરધારકોને સંબંધિત મીટિંગોમાં ભાગ લેવાની વિનંતી છે.

ı	ક્રમ	મીટિંગનો વર્ગ	મીટિંગોની તારીખ	સમય (આઇએસટી)
	٩	ઈએસપીએલના અનસિક્યોર્ડ ક્રેડિટર્સ	૨૮મી મે, શુક્રવાર, ૨૦૨૧	૧૦.૦૦ સવારે
	૨	ટીએઆઈએસપીએલના અનસિક્યોર્ડ ક્રેડિટર્સ		સવારે ૧૧:૩૦
	3	માસ્ટેકના અનસિક્યોર્ડ ક્રેડિટર્સ		બપોરે ૦૧:૦૦
ı	8	માસ્ટેકના ઈક્વિટી શેરહોલ્ડર્સ		સાંજે ૦૫:૦૦

વ્યવસ્થાની યોજનાની નકલ અને કાયદાના સેક્શન ૧૦૨ સાથે અન્ય લાગુ પડતી જોગવાઈઓને કંપનીના નિયમ ૬ (કોમ્પ્રોમાઇઝેસ, એરેન્જમેન્ટ્સ અને એમલ્ગમેશન) નિયમો, ૨૦૧૬ (સીએએનિયમો) અને એની સાથે પરિશિષ્ટો સાથે વંચાણે લેતા ૨૩૦(૩) હેઠળના એક્સ્પ્લેનેટરી સ્ટેટમેન્ટની નકલ જે કેપનીની વેબસાઇટ www.mastek.com અને શેરબજારો એટલે કે બીએસઈ અને એનએસઈની વેબસાઇટ એટલે કે અનુક્રમે વેબસાઇટ www.bseindia.com બને www.nseindia.com અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડની વેબસાઇટ www.evoting.nsdl.com પરથી ચકાસણી/ડાઉનલોડ થ શકશે. જો કોઈ વ્યક્તિ ઇચ્છતી હોય તો, સ્કિમની અને કાયદાના સેક્શન ૧૦૨ સાથે અન્ય લાગુ પડતી જોગવાઈઓને સીએએ નિયમોના નિયમ દ સાથે વંચાણે લેતા ૨૩૦ (૩) હેઠળના એક્સ્પ્લેનટરી સ્ટેટમેન્ટની છાપેલી નકલનિઃશુલ્ક રીતે ઈએસપીએલ, ટીએઆઇએસપીએલ અને માસ્ટેક કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસેથી અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ સીએસ શ્રી સંજય મજમુદારની ઓફિસ બી-303, જીસીપી બિઝનેસ સેન્ટર, મેમનગર ફાયર સ્ટેશન સામે, વિજય રસ્તા અમદાવાદ- ૩૮૦૦૧૪ ખાતેથી કોઈ પણ કામકાજી દિવસે તેમના વ્યવસાયના કલાકો (સવારે ૯.૩૦ અને સાંજે ૬.૩૦) સોમવારથી શુક્રવાર દરમિયાન અને મીટિંગની તારીખ સહિતના દિવસે મળી જશે.સદર આદેશને એમસીએ સર્ક્યુલર્સ અને સેબી સર્ક્યુલર્સ સાથે વંચાણે લેતા અનુસાર, ઉપરની મીટિંગોમાં પ્રોક્સી દ્વારા મતદાન માટે પરવાનગી આપવામાં આવશે નહીં.

. નામદાર એનસીએલટીએ શ્રી એસ. સાંડિલ્યને સદરહુ મીટિંગોના અધ્યક્ષ તરીકે નીમેલ, પરંતુ એમનાથી ન થવાથી શ્રી. આશંક દેસાઈને અધ્યક્ષ તરીકે નીમ્યા છે વ્યવસ્થાની સ્કિમ, જો ઉપરની મીટિંગોમાં મંજૂર થાય છે, તો તે અન્ય નિયમન ઓથોરિટીઝની પશ્ચાત્ મંજૂરી અને નામદાર એનસીએલટીની સંમતિને આધીન

વધુમાં નોટિસ અત્રે આપવાની છે તે છેઃ

એમર્સોએ સર્ક્યુલર્સ અને સેબી સર્ક્યુલર્સ અને સેક્શન ૨૩૦(૪)ની જોગવાઈઓને કાયદાના સેક્શન ૧૦૮ સાથે વંચાણે લેતાં, કંપનીઝ (મેનેજમેન્ટ અને વહીવટ) નિયમો, ૨૦૧૪(નિયમો)ના નિયમ ૨૦ અને અન્ય લાગુપડતી જોગવાઈઓ સાથે વંચાણે લેતાં તેમ જ સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્ક્લોઝર જરૂરિયાતો) નિયમો, ૨૦૧૫ના નિયમ ૪૪ અને સેબીના સરક્યુલર નં. ઝહ્નઢ/ઢેંન્૩/ઝેંઇ/૨૦૧૭/૨૧ તા. ૧૦મી માર્ચ, ૨૦૧૭ના ૯મ ફકરાના અનુસારના પાલન સહિત ઉપરોક્ત મીટિંગોની નોટિસોમાં દર્શાવેલ વ્યવહારોનું કામકાજ ઈ-વોટિંગ એટલે કે મીટિંગો દરમિયાન રિમોટ-ઈ વોટિંગ સવિધા દારા અને ઈ-વોટિંગ સવિધા દારા થશે. કંપનીઓ મીટિંગો દરમિયાન રિમોટ-ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ સવિધા નેશનલ સિક્યોરિટીટ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) દ્વારા પૂરી પાડી રહી છે. મીટિંગો દરમિયાન રિમોટ-ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ માટે જરૂરી સૂચનાઓ ૨૩મી એપ્રિલ, ૨૦૨૧ની નોટિસોમાં દર્શાવેલી છે. આ સુવિધા માસ્ટેકના **કટ-ઓફ તારીખ એટલે કે ૧૯મી મે, ૨૦૨૧ના રોજ** ઈક્વિટી શેરધારકોને અને **કટ ઓફ તારીખ એટલે કે ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૦ના રો**જ ઈએસપીએલ, ટીએઆઈએસપીએલ અર્ન માસ્ટેકના અનસિક્યોર્ડ લેણદારોને આપવામાં

ઈએસપીએલ અને ટીએઆઇએસપીએલએ ૨૩મી એપ્રિલ, ૨૦૨૧ અને માસ્ટેકે ૨૪મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ અનસિક્યોર્ડ લેણદારોની મીટિંગોની નોટિસ અને એક્સ્પ્લેનેટરી સ્ટેટમેન્ટ ઇલેક્ટ્રોનિક મોડથી ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૦ મુજબના તેના તમામ અનસિક્યોર્ડ લેણદારોને ડિસ્પેચ કરવાનું પૂર્ કર્યું છે. અનસિક્યોર્ડ લેણદારોના મતાધિકારો અને મતનું મૂલ્ય ઈએસપીએલ, ટીએઆઈએસપીએલ અને માસ્ટેક પાસે **૧૫મી ડિસેમ્બર, ૨૦૨૦** મુજ તેમણે લેણી થતી બાકી ૨કમના પ્રમાણમાં ૨હેશે. જે વ્યક્તિ/હયાત ઇસમ ઈએસપીએલ, ટીએઆઇએસપીએલ અને માસ્ટેકના કટ–ઓફ્ર તારી^ડ અનસિક્યોર્ડ લેશદાર નથી તેશે અનસિક્યોર્ડ લેશદારોની મીટિંગની નોટિસને કેવળ જાણકારી તરીકે ગણવાની રહેશે.

માસ્ટેકે ૨૩મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ ઈક્વિટી શેરધારકોની મીટિંગની નોટિસ અને એક્સ્પ્લેનેટરી સ્ટેટમેન્ટ ઇલેક્ટ્રોનિક મોડથી જે ઈક્વિટી શેરધારકોન ઈ-મેઇલ આઇડી માસ્ટેક/ ડિપોઝીટરીઝ પાસે ૩૧, માર્ચ,૨૦૨૧ મુજબ નોંધાયેલ હશે તે તમામ સભ્યોને મોકલવાનું પૂરું કરેલ છે. ઈક્વિટી શેરધારકોને મતાધિકાર **કટ-ઓફ તારીખ ૧૯મી મે, ૨૦૨૧મુજબ** માસ્ટેકના પૂરેપૂરા ચૂકવાયેલ ઇક્વિટી શેરના મૂલ્યના પ્રમાણમાં રહેશે. જે વ્યક્તિ માસ્ટેકના કટ ઓફ તારીખે ઇક્વિટી શેરધારક નથી તેણે ઇક્વિટી શેરધારકોની મીટિંગની નોટિસને કેવળ જાણકારી તરીકે ગણવાની રહેશે.

ઈક્વિટી શેરધારકો અને અનસિક્યોર્ડ લેણદારોની ઉપરોક્ત મીટિંગોનો રિમોટ ઈ-વોટિંગ સમયગાળો **સોમવાર.૨૪મી મે.૨૦૨૧ના રોજ સવારે** 09.00 (આઇએસટી) વાગે શરૂ થશે અને ગુરુવાર, ૨૭મી મે, ૨૦૨૧ના રોજ સાંજે 05.00 (આઇએસટી) વાગે પૂરું થશે. આ ગાળા દરમિયાન પોતપોતાની કટ-ઓફ તારીખ મુજબના ઈક્વિટી શેરધારકો અને અનસિક્યોર્ડ લેણદારો તેમનો મત રિમોટ ઈ-વોટિંગ દ્વારા આપી શકશે. એનએસડીએલ દ્વારા રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ ગુરુવાર, ૨૭મી મે, ૨૦૨૧ના રોજ સાંજે 05.00 વાગે બંધ થશે. એક વાર કોઈ ઈક્વિટી શેરધારક અને અનસિક્યો લેણદાર દ્વારા રિમોટ ઈ-વોટિંગથી ઠરાવ પર મતદાન થઈ જાય કે એ પછી એમાં ફેરફાર કરવા દેવાશે નહીં

રિમોટ ઈ-વોટિંગ દ્વારા મત આપવાથી ઈક્વિટી શેરધારકો અને અનસિક્યોર્ડ લેણદારો મીટિંગોમાં જોડાવા અને ભાગ લેવાથી વંચિત નથી રહેતા, પરંતુ જેઓએ મીટિંગો અગાઉ મત આપી જ દીધા છે, તેઓ મીટિંગો દરમિયાન મત આપી શકશે નહી. મીટિંગો વખતે મત આપી શકાશે અને જેઓએ મીટિંગો અગાઉ પોતાના મત નથી આપ્યો તેઓ પોતાનો અધિકાર મીટિંગો દરમિયાન ઉપયોગ કરવા માટે પાત્ર ગણાશે ૩૧મી માર્ચ, ૨૦૨૧ની કટ-ઓફ તારીખ મુજબના માસ્ટેકના ઈક્વિટી શેરધારકો કે જેમણે પોતાના ઈમેઇલ એડ્રેસ માસ્ટેક/ડિપોઝીટરી પાસે રજિસ્ટર ન

કરાવ્યા હોય તેમને વિનંતી છે કે તેઓ તેમના ઇમેઇલ એડ્રેસ નોંધાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરેઃ અ) ફિઝિકલ મોડમાં શેર ધરાવનારા સભ્યો મહેરબાની કરીને જરૂરી વિગતો જેવી કે ફોલીઓ નંબર, શેરધારકનું નામ, શેર સર્ટિફિકેટની સ્કેન્ડ

કોપી(આગળથી અને પાછળથી), પાન(પાન કાર્ડની સ્વયંપ્રમાણિત સ્કેન્ડ કોપી), આધાર (આધાર કાર્ડની સ્વયંપ્રમાણિત સ્કેન્ડ કોપી)ઈમેઇલથી investor_grievances@mastek.comને મોકલી આપવી

બ) ડિમેટ મોડમાં શેર ધરાવનારા શેરધારકોને વિનંતી છે કે તેઓ તેમના ડીપીઆઇડી-સીએલઆઇડી (લાભાર્થી આઇડીના ૧૬ અંકના ડીપીઆઇડી + ૧૬ અંકના સીએલઆઇડી), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિડેટેડ ખાતા પત્રકની નકલ, પાન(પાન કાર્ડની સ્વયંપ્રમાણિત સ્કેન્ડ કોપી) આધાર (આધાર કાર્ડની સ્વયંપ્રમાણિત સ્કેન્ડ કોપી) ઈમેઇલથી investor_grievances@mastek.comને અથવા evoting@nsdl.co.inને મોકલી આપવી.

ક) કટ-ઓફ તારીખ એટલે કે ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૧ના મુજબના અરજદાર ડીમજર્ડ કંપની, અરજદાર રિઝલ્ટન્ટ કંપની ૧ અને અરજદાર રિઝલ્ટન્ટ કંપની રના અનસિક્યોર્ડ લેણદારો એનએસડીએલને evoting@nsdl.co.in પર પોતાના નામ, સરનામું, બાકી રકમ અને પાનની

વિગતો સાથે ઈમેઇલથી વિનંતી મોકલી આપવી. એનસીએલટીએ પોતાના ૧૨મી એપ્રિલ, ૨૦૨૧ના આદેશથી શ્રી. પ્રશાંત એસ. મહેતા, જાણીતા કંપની સેક્રેટરીને મીટિંગો દરમિયાન ઈ-વોટિંગ અને રિમોટ-ઈવોટિંગ દ્વારા વાજબી અને પારદર્શક રીતે વોટિંગ સ્કૂટિનાઇઝ કરવા સ્કૂટિનાઇઝર તરીકે નિયુક્ત કર્યા છે. સ્કૂટિનાઇઝર મીટિંગોના અધ્યક્ષને

પ્રસ્તાવોની તરફેણ અને વિરુદ્ધમાં પડેલ મતો અને હોય તો અમાન્ય મતોનો સ્કૂટિનાઇઝરનો લેખિતમાં કોન્સોલિડેટેડ રિપોર્ટ તૈયાર કરશે. સ્ક્રટિનાઇઝરના રિપોર્ટ સાથે મીટિંગોના પરિશામો ઈએસપીએલ. ટીએઆઇએસપીએલ અને માસ્ટેકની રજિસ્ટર્ડ ઓફિસો ખાતે દર્શાવવામાં આવશે માસ્ટેકના ઈક્વિટી શેરધારકો અને અનસિક્યોર્ડ લેણદારોની મીટિંગોના પરિણામો પણ એની વેબસાઇટ www.mastek.com, શેરબજારો એટલે કે જ્યાં એની સિક્યોરિટીઝ લિસ્ટેડ છે તેમની વેબસાઇટ્સ પર અને એનએસડીએલની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ દર્શાવાશે અને ઈએસપીએલ અને ટીએઆઇએસપીએલના અનસિક્યોર્ડ લેશેદારોની મીટિંગોના પરિશામો એનએસડીએલની વેબસાઇટ www.evoting.nsdl.com પર દર્શાવાશે

મીટિંગો દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ માટે જો તમારી કોઈ ફરિયાદ હોય, તો ઈક્વિટી શેરધારકો એ અનસિક્યોર્ડ લેણદારો ટોલ ળી નંબઃ ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ / ૧૮૦૦ ૨૨૪ ૪૩૦ પરથી એનએસડીએલને ફોન કરી શકે છે. મીટિંગ દરમિયાન પોતાના દષ્ટિકોણ વ્યક્ત કરવા અને વ્યવસ્થાની યોજના અંગે સ્પષ્ટતા મેળવવા માટે સંબંધિત ઈક્વિટી શેરષારકોને તેમના નામ બોલનારા તરીકે મીટિંગના ઓછામાં ઓછા બે દિવસ અગાઉ પોતાના રજિસ્ટર્ડ ઈ-મેઇલ એડ્રેસ પરથી પોતાનું નામ, ડીમેટ ખાતા નંબર /ફોલિએ

નંબર, ઈ-મેઇલ આઇડી, મોબાઇલ નંબર વગેરે વિગતો સાથે investor_grievances@mastek.com ને મોકલી આપવા. તારીખ : એપ્રિલ 24, 2021 માસ્ટેક લિમિટેડના ઈક્વિટી શેરધારકો અને તમામ અરજદાર કંપનીઓન

અનસિક્યોર્ડ લેણદારોની મીટિંગ માટે નામદાર

એનસીએલટી દ્વારા નિયુક્ત અધ્યક્ષ

લહેરે સુનામીનું રૂપ ધારણ કરી લીધું ઉત્પાદન પણ સામેલ છે, જેથી આ છે. જુદા જુદા રાજ્યોની ઈમરજન્સી સ્થિતિમાં અન્ય હોસ્પિટલોમાંથી ઓક્સિજન ખતમ રાજ્યોને મદદ કરી શકાય. DFCCIL દ્વારા જાહેર કરાયેલું જાહેરનામું

સ્તરે મદદ કરશે.

રેલવે એક્ઝિક્યુટિવ અને મેનેજરની ભરતી કરશે નવીદિલ્હી તા.૨૫ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ૨૩મે સલાહ છે કે, આવેદન અરજી

તબીબી પરીક્ષણ પછી કરવામાં છે.

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વેબસાઇટ લિમિટેડમાં (DFCCIL) એક્ઝિક્યુટિવ સહિત વિવિધ પોસ્ટ્સ માટે ૧૦૭૪ ભરતી છે. ડી.એફ.સી.સી.આઇ.એલ.એ ભારતીય રેલ્વે હેઠળ આવનારું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. તે દેશના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપક્રમોમાંનું એક છે. ડીએફસીસીઆઈએલ દ્વારા લઈને અરજી કરી શકે છે. મુજબ જુનિયર મેનેજર, જાહેરનામાં જણાવાયું છે કે, અંગ્રેજીમાં હશે. એક્ઝિક્યુટિવ અને જુનિયર ખાલી જગ્યાઓની સંખ્યા ઘટી ભરવાની છે.

ડીએ ફસીસીઆઈએ લ રહેશે.

https:// **DFCCIL**+ii

ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ, તબીબી પરીક્ષણ પછી કરાશે

ડીએફસીસીઆઈએલમાં સુધી અરજીઓ કરી શકાશે. કરતા પહેલા આખું ભરતી ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર તેની પરીક્ષા જૂનમાં લેવામાં નોટિફિકેશ જરૂર વાંચી લે. ધ્યાન આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, આવે તેવી સંભાવના છે. રાખો કે, ઇન્ટરવ્યૂ સમયે દસ્તાવેજ, ચકાસણી અને અરજીઓઓનલાઇન કરવાની શૈક્ષણિક યોગ્યતા ડિગ્રી/ ઉમેદવારો પ્રમાણપત્ર પણ રજૂ કરવાના

ડીએ ફસીસીઆઈએ લમાં આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ, ચકાસણી અને તબીબી પરીક્ષણ પછી કરવામાં આવશે. કમ્પ્યુટર આધારિત સાદું ભોજન કરતો હતો. આથી હું શારીરિક રીતે નબળા બનાવે છે. પરીક્ષણ બે કે ત્રણ સત્રોમાં લેવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ પરીક્ષા બે કલાકની રહેશે. આમાં ૧૨૦ ઓબ્જેક્ટિવ ટાઇપ પ્રશ્ન હશે. જાહેર કરાયેલા જાહેરનામા ડીએફ્સીસીઆઈએલની ભરતી પ્રશ્નપત્ર ફક્ત હિન્દી અને

ઉમેદવારો ખાસ ધ્યાન આપે એક્ઝિક્યુટિવની જગ્યાઓ અથવા વધી શકે છે. વિવિધ પદો કે, પરીક્ષામાં નકારાત્મક માર્કિંગ માટે શૈક્ષણિક યોગ્યતા અલગ પણ આવશે. ખોટા જવાબો માટે ૨૪મી એપ્રિલથી અરજીની અલગ છે. જે માટે અરજદારોને ક્વાર્ટર માર્ક કાપવામાં આવશે. केन्द्रीय कार्यालय : J-460, हनुमान मन्दिर, गली नं. 12, करतार नगर, पोन्डा, उत्तर पूर्वी विल्ली-110053.

अर्जुनदास चेला भागीरथ दास को खाकी अखाड़ा से बहिष्कृत किया भागीस्थ दास से कोई संबंध न रेखें।